

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન માટે 12 નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સની ઘોષણા કરવામાં આવી

બ્રમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 15, 2020) – ગઈકાલે, એવી જાહેરાત કરવામાં આવી હતી કે સીટી ઓફ બ્રમ્પટન વર્ષ 2012 નાં અંત સુધીમાં 12 નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સને ચાર સગવડોમાં ઇન્સ્ટોલ કરવા ભંડોળ મેળવશે. આ ચાર્જિંગ સ્ટેશન્સ પીલ ક્લાર્કમેટ ચેન્જ પાર્ટનરશીપ અને નેચરલ રિસોર્સિસ કેનેડાના ઝીરો એમિશન વેલિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામમાં આપણાં શહેરની સહભાગિતા મારફતે શક્ય બનાવાયા હતા.

ગ્રીન સીટી (હરિયાળુ શહેર) બનાવવાની કટિબદ્ધતાને વળગી રહીને, વર્ષ 2019 માં, બ્રમ્પટન સીટી કાઉન્સિલે શહેરમાં ઉત્પન્ન થતું ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન વર્ષ 2050 સુધીમાં 80 ટકા જેટલું ઘટાડવાનો હેતુ ધરાવીને આબોહવામાં કટોકટીની ઘોષણા કરવા સર્વસંમતિ દર્શાવતો મત આપ્યો હતો. રહેવાસીઓને પોતાની આસપાસ હરવા-ફરવાની રીત પર પુનર્વિચાર કરવા અને વધારે ટકાઉ પરિવહન પસંદગીઓને પ્રોત્સાહિત કરવા, અને છેવટે GHGs ઘટાડવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ રહેવાસીઓને પ્રોત્સાહિત કરે છે.

નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ નીચેના સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવશે:

- કેસી કેમ્પબેલ રિક્લિએશન સેન્ટર - 2
- લોફર્સ લેક રિક્લિએશન સેન્ટર - 2
- ચિંગકુસી વૅલનેસ સેન્ટર - 4
- રિવરસ્ટોન કમ્યુનિટી સેન્ટર - 4

સીટીના ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca

ઝડપી માહિતી

- સીટી ઓફ બ્રમ્પટનમાં વિવિધ મ્યુનિસિપલ પાર્કિંગ લોટ્સમાં અને શહેરભરની સીટીની સગવડોમાં 53 હયાત ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ છે જે બ્રમ્પટનમાં રહેવાસીઓ અને ધંધાઓ માટે ઇલેક્ટ્રિક વાહનો બનાવવાનું વધારે અનુકૂળ કરવામાં મદદરૂપ થાય છે.
- બ્રમ્પટનના ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન્સ જાહેર જનતાના ઉપયોગ માટે મફત રહે છે. પેં પાર્કિંગ લોટ્સમાં સામાન્ય પાર્કિંગ ફી લાગુ પડે છે.
- સીટી કાઉન્સિલે બ્રમ્પટનમાં વર્ષ 2050 સુધીમાં 80 ટકા જેટલું GHGs ઘટાડવાનું લક્ષ્ય જૂન 2019 માં નિર્ધારિત કર્યું હતું. સીટી તે લક્ષ્ય હાંસલ કરવા શેરિડેન કોલેજની ભાગીદારીમાં કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન્સ પ્લાન (CEERP) વિકસાવવા સહિત, સંખ્યાબંધ પગલાઓ લઈ રહ્યું છે.
- CEERP પ્લાન એકવાર પૂરો થાય એટલે તેનો હેતુ મ્યુનિસિપાલિટી, સ્થાનિક યુટિલિટીસ અને સામુદાયિક હિતધારકોના પ્રયત્નોને એકીકૃત કરવાનો અને ઊર્જા કાર્યક્ષમતા સુધારતી, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડતી, ઊર્જા સુરક્ષાની ખાતરી કરાવતી, આર્થિક લાભ આપતી, અને આબોહવા ફેરફાર સામે સ્થિતિસ્થાપકતા વધારતી માર્ગરેખા બનાવવાનો રહેશે.
- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) આબોહવામાં ફેરફાર સામે લડત આપવામાં અગ્રણી 9,200 થી વધારે શહેરોમાં પોતાના જેવું પ્રથમ વૈશ્વિક જોડાણ ધરાવતી, ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાર્કમેટ એન્ડ એનર્જી નામક સંસ્થાના સભ્ય છે.

પીલ ક્લાર્કમેટ ચેન્જ પાર્ટનરશીપ વિશે

પીલ ક્લાર્કમેટ ચેન્જ પાર્ટનરશીપ પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરશે અને દરેક સભ્ય સંસ્થાને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં અને આબોહવામાં ફેરફારને અનુકૂળ થવામાં મદદ કરતું ભંડોળ આરક્ષિત કરશે.

આ પાર્ટનરશીપમાં સામેલ છે:

- રીજીયન ઓફ પીલ
- સીટી ઓફ બ્રમ્પટન
- ટાઉન ઓફ કેલેડોન
- ક્રેડિટ વેલી કન્ઝર્વેશન
- સીટી ઓફ મિસિસાગા
- ટોરોન્ટો એન્ડ રીજીયન કન્ઝર્વેશન ઓથોરિટી

અવતરણો (ક્વોટ્સ):

“ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જીના સભ્ય તરીકે, હું રોમાંચિત છું કે આપણાં શહેરને બ્રમ્પટનમાં 12 નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ માટે ભંડોળ મળી રહ્યું છે. બ્રમ્પટન એક ગ્રીન સીટી છે, અને સ્થાનિક સ્તરે વધારે ટકાઉ પરિવહન પસંદગીઓ ઉપલબ્ધ હોવાથી, અમે વર્ષ 2050 સુધીમાં 80 ટકા જેટલું GHGs ઘટાડવાનું અમારું મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“મ્યુનિસિપાલિટીસ અડધોઅડધ કેનેડાના GHG ઉત્સર્જન પર પ્રભાવ પાડવાની સાથે સાથે, આપણે અહીં બિલકુલ ધરે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની નવી રીતો શોધવાનું ચાલુ રાખવું રહ્યું. આપણે સૌ વધારેને વધારે ગ્રીન સીટી બનાવવાનું ચાલુ રાખવા આપણો ભાગ ભજવીએ ત્યારે આ નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ આપણાં સમુદાય માટે ટકાઉપણને વધારે સરળ બનાવશે.”

શર્મેઈન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8, ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ

“સીટીનું પીલ ક્લાઈમેટ ચેન્જ પાર્ટનરશીપ સાથે મળીને કામ કરવાનો અર્થ એ થાય કે આપણે ભાવિ પેઢીઓ માટે વધારે હરિયાળો સમુદાય અને આરોગ્યપ્રદ વાતાવરણ બનાવવા વિસ્તારના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરવામાં સક્ષમ બનીએ છીએ. આ ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ સમગ્ર પીલ રીજીયનમાં સહયોગ વગર શક્ય બનશે નહિ અને તે બ્રમ્પટનવાસીઓ માટે પર્યાવરણલક્ષી અનુકૂળ નિર્ણયો વધારે સરળ પસંદગી બનાવે છે.”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ

“વિવિધ મ્યુનિસિપલ પાર્ટિંગ લોટ્સમાં અને સમગ્ર બ્રમ્પટનમાં સીટીની સગવડોમાં 53 ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સ પહેલેથી હયાત હોવા ઉપરાંત, 12 નવા ઇલેક્ટ્રિક વેલિકલ ચાર્જિંગ સ્ટેશન્સથી આપણાં સમુદાયમાં ટકાઉ પરિવહન એક વધતી જતી પહોંચ સુલભ પસંદગી બનશે. કર્મચારીગણ બ્રમ્પટનને ગ્રીન સીટી બનાવવાની અગ્રતાને સહાયરૂપ બનવા આપણાં ભાગીદારો અને રહેવાસીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખવા સમર્પિત છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्युटात्मक संवाद

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca